

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી દાહોદ ખાતે ન્યુ ઇન્ડિયા મંથન- સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ અને આત્મા પ્રોજેક્ટ,દાહોદના સંયુક્ત ઉપક્રમે તા:૦૮/૦૯/૨૦૧૭ના ના રોજ કે.વિ.કે., આ.કૃ.યુ., મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ન્યુ ઇન્ડિયા મંથન- સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમનું આયોજન માન.કેન્દ્રિય મંત્રીશ્રી, ભારત સરકાર શ્રી જશવંતસિંહજી ભાભોર સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવેલ.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી જે. રંજીથકુમાર, માન.કલેક્ટરશ્રી દાહોદ, શ્રી સુજલ મયાત્રા, માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી, દાહોદ અને ડૉ. અરૂણ પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ કટારા, માન. ધારાસભ્ય(ફતેપુરા)અને અન્ય જાહેર પ્રતિનિધિઓ, આમંત્રિત સભ્યો તરીકે લાઇન વિભાગના વિવિધ અધિકારીઓ અને આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદના વૈજ્ઞાનિકો તેમજ અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.

કાર્યક્રમની શરૂઆત સમુહમાં રાષ્ટ્રગીતથી કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું કૃષિ ઇજનેરી પોલીટેકનીક, દાહોદની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમને આગળ ધપાવતાં આવેલ તમામ મહેમાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તેવા તમામ ખેડૂત ભાઈઓ, બહેનો અને યુવાનોનું શાબ્દિક સ્વાગત કે.વિ.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, ડૉ. યુ. એમ. પટેલે કર્યું. ભારતીય સંસ્કૃતી પ્રમાણે આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

કાર્યક્રમને આગળ વધારતાં ડૉ. યુ. એમ. પટેલે માન. પ્રધાન મંત્રીશ્રીનો ખેડૂતો માટેનો સંદેશ વાંચી તેમની વોડિયો ફિલ્મ મહાનુભાવો અને ખેડૂતો સમક્ષ રજૂ કરી. ત્યારબાદ આવેલ તમામ મહેમાનો અને ખેડૂતોને ડૉ. અરૂણ પટેલ દ્વારા નવ ભારત નિર્માણનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી જે. રંજીથકુમારે ખેડૂતોની ૨૦૨૨ સુધી બમણી આવક મેળવવાના હેતુસર કટિબધ્ધ થવા ઉદ્બોધન આપ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી, ભારત સરકારે જણાવ્યું હતું કે, ન્યુ ઇન્ડિયા મંથન-સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ ૨૦૧૭ થી ૨૦૨૨ને સાર્થક કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કૃત નિશ્ચિતી છે. કૃષિ મહોત્સવો, કૃષિ વૈજ્ઞાનિકો, નિષ્ણાતોના માર્ગદર્શન, તાલિમો અને સેમિનારો થકી ગુજરાત રાજ્યે કૃષિ વિકાસ દર સાથે કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો છે. ખેતી સાથે સાથે પશુપાલન અને સંલગ્ન કૃષિ વ્યવસાયો પણ જિલ્લાના ખેડૂતો રૂચીથી અપનાવે અને તેમની આવકમાં બહોળો વધારો કરે. મહાનુભાવોના ઉદ્બોધન બાદ તેમના હસ્તે ગ્રામ સેવકોને મફત ટેબ્લેટ વિતરણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,આ.કૃ.યુ.,દાહોદના પ્રગતીશીલ ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન અને અને જમીન સ્વાસ્થ્ય કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ. દાહોદ જીલ્લાના ખેડૂતોની આવક બમણી કરવા કટિબધ્ધ છે અને આણંદ કૃષિ યુનિવર્સિટીની વિવિધ નવીન તજજ્ઞતાઓ ખેડૂતો અપનાવતા થાય તે અંગે સમયાંતરે મુલ્યાંકન કરતું જ રહેશે અને જરૂરી માર્ગદર્શન પુરું પાડશે.

આ કાર્યક્રમમાં કુલ ૨૫ પબ્લિક પ્રતિનિધિઓ, ૯૭ અધિકારીઓ અને વિસ્તરણ કાર્યકર્તાઓ અને ૧૫૧૪ ખેડૂતો, મહિલા ખેડૂતો અને ગ્રામીણ યુવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભરે ભાગ લીધો હતો.

કાર્યક્રમનું સંચાલન પ્રો. એન. કે. રાહોડ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. એસ. કે. પટેલ, વૈજ્ઞાનિક (કૃષિ ઇજનેર), ડૉ. આર. રાધારાની, વૈજ્ઞાનિક (પશુપાલન), પ્રો. એચ. એલ. કાયા, વૈજ્ઞાનિક (બાગાયત), પ્રો. જી. કે. ભાભોર, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), પ્રો. એન. ડી. મકવાણા, વૈજ્ઞાનિક (સસ્ય વિજ્ઞાન), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ. દાહોદ તથા હલકા ધાન્ય યોજના, આ.કૃ.યુ. દાહોદ અને પોલીટેકનીક કૃષિ ઇજનેરી, આ.કૃ.યુ. દાહોદના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ખુબ ભારે જહેમત ઉપાડી હતી.



